

# **INTEGRATED PROTEINS LIMITED**

City Point, 5<sup>th</sup> Floor, Opp. Town Hall, Jamnagar – 361 001,Gujarat,India

Phone: (0288) 2551901 Fax: (0288) 2552566 Email ID: <u>ipl.complianceofficer@gmail.com</u>

Website: www.integratedproteins.com

CIN: L15400GJ1992PLC018426

Date: 5th December, 2024

Ref: IPL/BSE/Regulation 47

To, **Department of Corporate Service**BSE Limited

PhirozJeejeebhoy Towers,

Dalal Street,

Mumbai – 400 001

Sub: Announcement under Regulation 47 of SEBI(LODR) Regulations, 2015.

Ref: Scrip Code - 519606

Respected Sir / Madam,

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing the copies of newspaper advertisement published in the Economic Times and Navgujarat Samay. The same has been made available on the Company's website (<a href="https://www.integratedproteins.com">www.integratedproteins.com</a>)

This is for your record and reference.

FOR, INTEGRATED PROTEINS LIMITED

CS Devanshi V. Shah(A50711)
Company Secretary and Compliance Officer

**FOLLOWING A DECLINE IN INTERNATIONAL OIL PRICES** 

# Windfall Tax on Domestic Crude, Fuel **Exports Scrapped After 30 Months**

Road and infrastructure cess levied on export of petrol and diesel also withdrawn

Our Bureau

New Delhi: India Monday scrapped the 30-month old windfall profit tax on domesti-cally-produced rade oil and on expect of jetfuel (ATF), die-sei and petrol following a de-settoral oil pricsei and petroi iollowing a de-cline in international oil pric-

The government has collect-ed Rs 44,000 crore from the windfall tax since it was first imposed in July 2022.

Minister of state for finance Panka; Chaudhary tabled a notification in Parliament scrapping the levy. The notification rescinded June 30, 2022 order and with drew levy of succial addition.

June 30, 2022 order and with-drew levy of special addition-al excise duty (SAED) on pro-duction of crude oil (which is-refined into fuels like petrol and diesel) and on export of aviation turbine fuel (ATF), diesel and petrol, the notifica-

Windfall Tax Collections WINDFALL TAX WAS FIRST IMPOSED IN JULY 2022

Road and A 223,250 per Infrastructure tonne tax cess on Petrol diesel scrapped produced crude FM CITED "PHENOMENAL J PROPITS" ON EXPORTS FOR THE TAX

tonsaid.

The move follows a recom-mendation in this regard by the petroleum and natural gas ministry. "The levy has served its purpose...," a government official said.

Attracture, export nurses or to per litre (Si2 per barrel) has also withdrawn the road each were levied on petrol and and infrastructure ces (RiC). ATF and Cl3 a litre (Söa a barelevied on export of petrol and rel) on diesel. A C2,230 per

profit tax on domestic crude production was also levied. Finance minister Nirmala Sitharaman had then said phenomenal profits on exports at the expense of domestic availability forced the gortist and the said phenomenal profits on exports at the expense of domestic availability forced the gortist of the profits of the said of the said that the said the said that the said the said that the said the said th

allability of capacity to meet de-

### **Priyanka Sits Next to Rahul** in Front Row

in Front Row

Wew Dalhir: Newly-lacked

Member of the Loke Sabeta

New Dalhir: Newly-lacked

Member of the Loke Sabeta

Newly and the Sabeta

Design of the Loke Sabeta

Design of the Loke

Newly and the Sabeta

Rahul Gandhi, who is the

leader of the Opposition The

sliblings were sitting togeth
or, charting and looking at the

Congress MR's, who were

raising segment own to Well

sembled at 12 mon after the

first adjournment at 11 am.

They remained so till the

House adjourned for the day

within a few minutes.

within a few minutes. While Vadra sitting next to Gandhi coincided with chat While Vadra sitting next to Gandhi coincided with chait er about the emerging 'dual centres of power' in the Con-gress benches in the Lok Sab-ha, some party MPS siter said she has been formally allot-ted a third row east, still an upgradation for a first etern-on, but they also added there can't be any been on Visita from sitting rost to adult in the construction of the variety of the con-traction of the con-erciant power of the con-erciant power of the con-traction of t

mand in the winter and is taking steps to ensure that there is no shortfall, an official said. Electricity demand has risen

# Peak Power Demand may Rise 5.4-7.8% between Dec & Feb

vernment official told ET. The projections could change in line projections could change in line with moderation in weather fo-recast, another official said. Last year, peak demand recor-ded in December was around 214

diesel.

The government hadfirst imposed windfall profit taxes on July 1, 2022 to tax super normal profits of energy compa-

nies. At that time, export duties of

# **Factory Activity at** 11-mth Low in Nov **Amid Cost Pressure**

New Delhi: India's manufactu-ring sector activity slowed to an Il-month low in November, pul-ied down by cost pressures and low orders, a private sturvey rele-ased on Monday showed.

ased on Monday showed.
The HSBC India Manufactu-ring Purchasing Managers' In-dex (PMI), compiled by S&P Clo-bal, stood at 565. It had picked up pace in October with a reading of 57.5 from 85.5 in September In November 2023, the PMI reading

November 2023, the PAUTERALING was 55. Despite the decline, the growth rate remained above its long-rum average. A PMT reading above 50 signals expansion, while a reading below indicates cont-

reading below indicates contraction.

"Strong broad-based interna-ional demand, evidenced by a four-mostly high in new export orders, fuelled the Indiam manuracture of the Contraction of the Contraction

Haudings in the processures, it said.
Selling prices or charge inflation hit an II-year high, while input cost inflation was the highest since July although still be-

has since our amongs an ob-low its long-run average.

"Input prices for a variety of intermediate goods, including chemicals, cotton, leather, and rubber, rose in November, while output prices soared to an ele-

Focus on

ven-year high as rising input, la-bour and transportation cests were passed on to consumers." salf iBandart.
In October, India's retail infla-tion had soured to a 14-month high of £0."2, above the RBI sto-lerance barxt, mainly on acco-tunt of rising food prices. It was 5.49 % in September.
While domestic sales were im-pacted by cost pressures, new ex-port orders gained immentum. "The rate of expansion in in-ternational demand was the lest seen for four morths with least seen for four morths, with Bangladesh, minimed. China, Colombia, Iran, Italy, Japan, No-pel, the UK and the US, "the sur-vey mentioned. Manufacturing was one of the primary contributors to the skewdown in India's gross do

Manufacturing was one of the primary contributors to the slowdown in India's gross do-mestic product (GDP') growth of 5.4% in July-September, mac-king a sever-quarter low according to the official data released last week. Meanwhile, factory employ-ment rose for the ninth consocu-tive month in Amounter, with produce the product of the product of the product of production slowed slightly from October, it remained solid, ac-cording to the survey. Business optimism was fuelled

initiatives and new product releases will yield positive results, it said. "Capacity expansion efforts and forecasts of demand strength also underpinned up-beat forecasts for output in 2025, "said HSBC India in the re-port.

## PM Internship Plan may be Unveiled this Month

Job-linked sops scheme may be launched jointly

New Delhi: The government is considering formally is considering formany set rolling the pilot project under the PM Internship scheme la-ter this month along with another critical job-related initiative, the employment linked incentive programme, people aware of the develop-

proper discentive programme, source of the development saud.

In the project of the internship scheme was proposed to be on December 2.

A precise date will soon be set and the schemes could be launched together as a package by Prime Minister Narendra Modi, they said.

"The pilot (PM Internship) scheme has not been put off or cancelled; work is very much going on. But its formal launch could now take place along with the other employment initiative, most likely at a later date this month," said one of the persons involved in the implementation of the scheme.

terms started work on Monagos palament headded.
The government will also so, on finalise the employment-linked incentive schemes proceed in the July Budget.
The person said offers are being extended to candidates under the pilot project of the internship scheme, which will be substantially expanded from next fiscal to accommodate more candidates, factoring in learnings from the Initial companion of the scheme, announced by the sound of the scheme, announced by the sound of the scheme, announced the scheme, announced by the scheme, announced the scheme, and the scheme, announced the scheme, and the scheme, announced the scheme, announced the scheme, and the scheme, announced the scheme, announced

launch could now take place along with the other employment initiative, most likely at a later date this month, "said one of the persons involved in the implementation of the implementation of the scheme. In fact, the first batch of in-many countries are the companies that have joined the project.

# Italy & India Maritime Ties

New Delhi: Italian policy makers, including a mini-ster, senator, defence se-cretary and ex-diplomatic advisor to PM Gleorgia Meloni, visited New Delhi and Mumbol last week and this week to push ma-ritime partnership with India as an immediate fol-ness, and the policy of the pro-ting partnership with India.

India as an immediate follow-up on the Joint Action Plan adopted at the PM-levelment in Brazil on the statellines of the G20 meet in November. More and the G20 meet in November. And the G20 meet in More and the G20 meet in G20 meet in

generations of nuclear po-wer systems.

Besides meeting Union commerce minister Piy-ush Goyal and Union mi-nister dealing with space, Urso also met Union coal minister to explore coope-ration in the critical mine-rals sector.

ration in the critical minerals sector
Over the weekend, a conference on Yilke and Space
Economy' was held at the
Villaggio Italia, set up at
the Indira Dock in Mumbal for the Vespucci World
Tour stop in India.
The event was inaugurated by the Italian Ambassador to India Antonio
Bartoli and attended by
Minister of Ports, Shipping and Waterways Sarbananda Sonowal and Urso. The Italian minister
highlighted how sixty years after the laumeh of the
first Italian satellite – San
Marco-I – made Italy the
third country to reach the
milestone in 1964 after the
them Soviet Union and
USA
Discussion former diplodentity of the control of the
Control of the control of the
milestone in 1964 after the
them Soviet Union and
USA
Discussion former diplodentity of the control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of the
control of

Meloni's former diplo-natic adviser and senior Meloni's former diplomatic adviser and senior diplomat Francesco Talo, who was in Mumbai over the weekend, said that ninsular countries which make them automatic partners. From Indo-pacific to Indo-Mediterranean, the idea is to create synery for trade by safeguarding freedom of navigation. Talo mentioned that the industry of the connect ports of the pacific to connect ports in Slovenia and Croatis. The two Phs have met five times in the last two years.

wed by a similar demand recor-ded in February. The power mi-nistry sees no issues with the av-

Electricity demand has risen in the last 10 days with the peak remaining over the 200-GW mark, "Western and northern region demand has already picked up," the official said.

# PUNUAB STATE TRANSMISSION CORPORATION LIMITED Regd. Office. PSEB Head Office. The William Co.

Regd. Office. PSEB Head Office, The Mall, Patiala-147001 Corporate Identity Number: - U40109PB2010SGC033814 C.E. / P&M, PSTCL, Ludhiana, Tel. No. 0161-2921735, Email: ce-pm@pstcl.org

Email: ce-pm@pestcl.org
Notice Inviting E-Tender
Tender Enquiry No. 172/2024-25
For Procurement of 6 No. Self Propelled Articulated Boom for 400KV Lines, Substations and for Grid construction, 1. Last date 8 time for downloading of tender-01/01/2025 upto 11 0.0 AM. 2. Last date 8 time for downloading of tender-01/01/2025 upto 11 0.0 AM. 3. Date 8 Time for oppening of tender-03/01/2025 at 11:00 AM. Date 8 Time for oppening of tender-03/01/2025 at 11:00 AM. Date 8 Time for oppening of tender-03/01/2025 at 11:00 AM. Date 8 Time for oppening of tender-03/01/2025 at 11:00 AM. Date 8 Time for oppening of tender-03/01/2025 at 11:00 AM. Date 8 Time for oppening of tender-03/01/2025 at 11:00 AM. Date 8 Time for oppening of tender-03/01/2025 at 11:00 AM. Date 8 Time for oppening of tender-03/01/2025 at 11:00 AM. Date 8 Time for oppening o

Addl. SE./ Procurement, Ludhiana



### MAHARASHTRA STATE ROAD DEVELOPMENT CORPORATION LIMITED (MSRDC)

ne digitally signed offers are invited by MSRDC from esforthe above work for initial contract Period of 1 Years

at 13 00 hrs.

The offers shall be submitted along with 15,00,000 (-(Five lacts only) as the EMD to be Paid through online payment gateway which can be accessed through thips.//mahatenders.gov.in.

Guidelines to download the offer document and online submission of offers can be download the offer document and online submission of offers can be downloaded from whole https://mahatenders.gov.in.

The last date of submission is 12/12/2024 till 15.00 hrs.

Vice Chairman & Managing Director

### PUBLIC NOTICE REGARDING LOSS OF ORIGINAL DOCUMENTS

iriginal Registration Receipt. Iriginal Registered Sale Deed No.: 9787, dated 29/07/2010 and it Iriginal Registration Receipt.

Original Registration Receipt.
Original Registered Sale Deed No.: 349, dated 17/10/1985 [Old N 11453 dated 21/12/1983] and its Original Registration Receipt.

dated 21/12/1983] and its Driginal registration received - :: Description of the Property ::see piece and parcels to the immovable property becomes No. 334/1, T. P. Schem No. 13 [Adajan], Final Plot No. 28, Admeasuring 71.56 Springland Sp



CM NO. JUSTICHAMISSISCIO ISAS

TENDER NOTE:

REQUEST FOR PROPOSAL (RFP) FOR APPOINTMENT OF

CONTRACTOR FOR THE LIFTING AND DISPOSAL OF

CORPORATION'S OWNED UNISOES MINOR MINERAL MATERIALS

SUCH AS SOIL, BOULDERS/AGGREGATES, AND MURUM ON

PLANTATION SITE ALONE THE HINDU HINDUY'S SAMRAT

ALASAHEB THACKAREY MAHARASHTRA SAMRUDDHI MAHAMARI

ALASAHEB THACKAREY MAHARASHTRA SAMRUDDHI MAHAMARI

ine digitally signed offers are invited by MSRDC from ties for the above work for initial contract Period of 1 Years

The our war assure work for initial contract Period of 1 Years.

The offer document can be viewed / downloaded through e-tendering portai https://mahatenders.gov.in form 03/12/2024 at 15.00 ars. to 12/12/2024 till 15.00 hrs. Pre Bid meeting will be held on 10/12/2024 at 13.00 hrs. art 3.00 ns.

The offers shall be submitted along with Rs. 5, 90,000f · (Five lacs only as the EMU to be Paid through online payment gateway which can be accessed through https://mahatendes.gov.lin.
Guidefines to devolved of the offer document and online submission offers can be downloaded from website https://mahatenders.gov.in.

offers can be downloaded from executing a remaining the first the fact that of submission is 12/12/2024 till 15.00 hrs Right to accept or reject any or all the offers without assigning any reason whatsoever is reserved with MSRDC.

VC & MD, MSRDC Ltd.

# Three EV Makers Raided for ₹297cr Subsidy 'Fraud'

Our Bureau

New Delhi: The corporate affairs ministry on Monday said the Serious Fraud Investigation Office (SFIO) has conducted searches at three electric vehicle manufacturers—Here Electric Vehicles. Benling India Energy and Autotich International. "These cases arise from the fraudulent availing of subsidies amounting to 2297 crore cumulatively by all the three companies under the Faster Adoption and Manufacturing of Electric Vehicles (FANE). Il scheme of the Ministry of Heavy Industries, the ministry of Heavy Industries, the ministry said in a statament.

flouting the PMP guide-lines under FAME – II", the ministry said.

said.
Evidences
like digital
data, books
and other
material
have been reoperations have been recovered during the search operations, it said, adding that further investigation is in progress.
The government had aunched the FAME II
scheme in 2019 with an outlay

electric and hybrid vehicles in India. The scheme and the PMP guidelines stipulated the manufacturing of some

key components in India, for the vehicle to be eligible for subsidy. For claiming subsidies, the three companies "had decep-tively shown compliance with the applicable guide-lines" to the heavy industries ministry, which was subse-quently found to be incorrect and false, according to the statement.

and false, according to the statement.
Subsidy disbursements in the programme were linked to the PMI to ensure higher localisation as years passed. While these companies did not adhere to the PMI? they continued seeking PAME subsidy, defeating the intent of the scheme, the heavy industries ministry had found.

### INTEGRATED PROTEINS LIMITED

CIN: L15400GJ1992PLC018426
Reg Office; 5th Floor, City Point, Opp, Town Hall,
Jamnagar, Gujarat, 361001. Contact: 0288 2551901,
Web: www.integratedproteins.com, Mail: ipl.complianceofficer@gmail.com

### NOTICE

NOTICE

NOTICE is hereby given to the members of INTEGRATED PROTEINS LIMITED (the "Company") that pursuant to the provisions of Section 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 (including any statutory modification(s) or re-enactment(s) thereof for the time being in force) (the "Act") read with Rule 20 and Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014 (the "Rules"), Circular Nos, 14/2020 dated April 08, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 20, 2020, 22/2020 dated June 15, 2020, 33/2020 dated September 28, 2020, 33/2020 dated December 31, 2020, 10/2021 dated December 88, 2021, 03/2022 dated May 95, 2022, 11/2022 dated September 28, 2022 and 09/2023 dated September 25, 2023 issued by the Ministry of Corporate Affairs ("MCA") (increinafter collectively referred to as "MCA Circulars"), Regulation, 44 and other applicable provisions, if any of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, ("Listing Regulations"), read with applicable circulars under the Act and Listing Regulations, Secretarial Standard on General Meetings ("SS-2") issued by the institute of Company Secretarial Standard on General Meetings ("SS-2") issued by the institute of Company Secretaries of India, the Articles of Association of the Company and subject to other applicable laws, rules and regulations, (including any statutory modifications) or re-enactment(s) threach, for the time being in force, for seeking approval of the shareholders of the Company for the business set out hereunder through Postal Ballot ("the Postal Ballot") by way of remote e-voting ("e-voting") process.

hereunder through Postal Ballot ("the Postal Ballot") by way of remote e-voting ("e-voting") process.

The notice has been sent electronically to those members, whose email addresses were available with the company or the Depository Participant(s) for other members, who have not registered their email addresses, for those the Notice has been uploaded on company's website i.e. www.integratedproteins.com and on BSE's Website i.e. https://www.bseindia.com/.

The voting rights of Members shall be in proportion to their shares of the paid-up equity share capital of the Company as on the cut-off date i.e., Friday, November 29, 2024.

2024
In compliance with the provisions of Sections 108 and 110 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company provides the Members the facility to exercise their right to vote by electronic means through e-voting services provided by NSDL and the business may be transacted through such voting. The instructions for e-voting are annexed to this Notice. The details pursuant to the act are as under:

a) Members holding shares either in physical form or in dematerialized form, as on the Cut-Off Dato, i.e. Friday, November 29, 2024 (eligible members), to exercise their right to vote by remote a-voting on any or all of the businesses specified in the Notice.

b) The remote e-voting will commence on Saturday November 30, 2024 from a 0.

The remote e-voting will commence on Saturday, November 30, 2024 from 9.00 a.m. (IST) and shall end on Monday, December 30, 2024 at 5.00 p.m. and the remote e-voting module shall be disabled for voting thereafter and voting through electronic means shall not be allowed thereafter. Once the vote on resolution is cast by the member, the member shall not be allowed to change it

resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently.

c) in case a person has become the member of the Company after the dispatch of Notice but on or before the cut-off date i.e. Friday, November 29, 2024, may write to Ms. Devanshi shah, (Complaince) of Grice of the Company) at the Registered Office of the Company) at the Registered Office of the Company Situated at City Point, TownHall, Jamnagar - 361005 at email ID ipl.complianceofficer@gmail.com for obtaining the credentials for mole e-voting;

d) The resolution, if passed by the requisite majority through Postal Ballot, will be deemed to have been passed on the last date specified for voting i.e. Monday, December 30, 2024. Further, resolution passed by the members through postal ballot are deemed to have been passed as if they are passed at a General Meeting off the Members.

e) All material documents referred to in the explanatory statement will be available for inspection at the Registered Office of the Company during office hours on all working days from the date of disporth until the last date for receipt of votes by evoting. Alternately, Members may also send their requests to pl.complianceofficer@gail.com in from their registered e-mail address mentioning their names, foilo numbers, DP ID and Client ID during the voting period of the postal ballot notice, the Company will send the same, free of oost, upon receipt of request from the member, in case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions (FAGS) and e-voting manual available at www.veotingindia.com under help section or write an email to evoting@gmsd.co. in The Notice will be available or inspection at the registered office of the Company during office hours. our website www.integratedproteins.com Further, these documents a inspection at the registered office of the Company during office hours.

Date: 30th November, 2024

CS Devanshi V. Shah

# 🔀 बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

SALE NOTICE (AUCTION OF PLEDGED GOLD ITEMS)

Sr. No.	Branch Name	Name of Borrower & Guarantor	Borrower Account Number	Total Grams	Total Net Weight	Outstanding Amount AS ON 28-11-2024
1	DIWALIPURA VADODARA	Smt. Sangeeta Mohan Oza	58280400000071	777.150	687.000	2229291.20+ unapplied Int From 27-10-2023+ Legal Charges +other Charges
2	DIWALIPURA VADODARA	Kanak Patel	58280600002957	187.000	181.000	799546.00+ unapplied int From 19-06-2024+LEGAL CHARGES +OTHER CHARGES
3	DIWALIPURA VADODARA	Kanak Patel	58280600003015	199.300	194.500	820503.00+ unapplied Int From 19-06-2024+LEGAL CHARGES +OTHER CHARGES
4	DIWALIPURA VADODARA	Kanak Patel	58280600003360	92.000	90.500	356064.00+ unapplied int From 19-06-2024-LEGAL CHARGES

## નવા ફાયર સ્ટેશનનું નિર્માણ જાન્યુઆરી સુધીમાં પૂરું કરવા તાકિદ

# ગાંધીનગરમાં વિકાસકાર્ચોમાં વિલંબ એક્સેસ બિલ સામે મેચરની લાલ આંખ

કુડાસણમાં લાઈબરેરી અને PHCનું ડિસેમ્બરમાં લોકાર્પણ કરવા સૂચના

**ા** ગાંધીનગરમાં સંખ્યાબંધ વિકાસ કાર્યો ચાલી રહ્ય છે. મોટાભાગના વિકાસ કાર્યોમાં નિયત સમયમર્યાદામાં કામ પૂર્ડુ થતું નથી. વળી, કામ પૂર્ડુ થતાં પહેલાં ટેન્ડરમાં અન્ય ક્રામ ઉમેરવાના કે અન્ય કારક્ષોસર ટેન્ડરની મૂળ રકમની સરખામક્ષીએ ખર્ચ વધી જાય છે અને એક્સેસ બિલનાં ચૂકવલાં કરાય છે. યેયર મીરાબેન પટેલે સોમવારે સંખ્યાબંધ વિકાસ કાર્યોની સાઈટ પર ઓચિતી મુલાકાત લઈ વિકાસ કાર્યોમાં સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને માનીતા ક્રોન્ટ્રાક્ટરો માટે એક્સેસ બિલો મંજુર

કરવાની પ્રવૃત્તિ શેકવા તાકિદ કરી હતી. મેયરે સિટી એન્જિનિયર તથા એન્જિનિયરિંગ શાખાને સાથે રાખી રક્ષાશક્તિ સર્કલથી સરગાસભ ચોકડી તરકના સર્વિસ રોડ ડેવલોપમેન્ટની કામગીરીની વાડાતા તરુપા લાત્સના કરવા કરવા કરવાના કરવાના તેવા વિક્રાસ અભ્યાસના લાહ્ય સર્વા સારા સ્ટાર્સ પર હાર્ક મુલાકાત લીધી, મેપરે ફૂટપાય, પાર્કિંગ, સ્ટ્રેસ વોટર, તે માટે ઝડપથી કાર્યો કરો સર્વા સ્ટ્રાસ સામા સ્ટ્રાય સ્ટ્રીટ લાઇટ, લેન્સર્સિપંગ, બેલ્ડ બલસ્થા સહિત હતી, આ લાઇમેરીમાં દુડાત્મણ સહિત આલપાસના તમામ મુદ્દે કામગીરીનું નિરીયણ કર્યું હતું, નાગરિકોની વિસ્તારના વિદ્યાર્થી, વ્યાવસાયિક કે સામાન્ય વ્યક્તિ



સુખાકારી જળવાય અને કરોડો રૂપિયાનો ખર્ચ એળે ન જાય તેની તકેદારી રાખવા અને ટેન્ડરમાં નિયત ગુણવત્ત સાથે કામગીરી સંપન્ન થાય તે માટે એન્જિનિયર સહિત અધિકારી કર્મચારીઓને સૂચના આપી હતી. કુડાસલ ખાતે લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. લાઈબ્રેરીના ભિલ્હિગમાં ફર્નિચર વર્ક, ઓડિયો વિઝ્યુઅલ રૂમ વગેરે તૈયાર છે, પરંતુ તેનું લોકાર્યણ થઈ શકે તેવી સ્થિતિ નથી. મેચરે એકાદ અઠવાડિયામાં લાઇબ્રેરીનું લોકાર્યણ થઈ શકે મળી રહેશે

વાવોલથી સરગાસણ આવતી કાંસની **બં**ને ભાજુ સર્વિસ રોડ ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે. નિયત બાજુ સાવસ રાડ ડવલાયમન્ટ થઇ ન સુષ્ઠ છે. ાનયન સમય-મર્ચાદામાં આ ક્ષમારી પાંચ ગુજ પૂર્ણ કરવા મેયરે સુચના આપી હતી. કુડસણ ખાતે નવનિર્મિત અાયુપ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત લીધી. આ દરમિયાન કમ્યાઇન વોલ, મેડિકલ સાપતો, આર.સી. સી. રો, પેવર ભ્લોક, ઈલેક્ટ્રીક સાપતો સહિત તથામ કામગીરી ઓર્ડર મુજબ થઈ હોવાની મહિતી મેળવી હતી અને સિમેળર મહિતો પૂરી થતાં પહેલાં આરોગ્ય હતી અને સિમેળર મહિતો પૂરી થતાં પહેલાં આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવા તાકિદ કરી હતી. સરગાસણ ખાતે ફાયર સ્ટેશન બિલ્ડીંગ | ઓફીસ અને સ્ટાફ ક્વાર્ટરની કામગીરી નિયત સમયમાં પૂરી થઈ શકી નથી, મેયરે કાયર સ્ટેશનની કામગીરી બે મહિનામાં નવા, મધર રૂપય કરદાવના કાવગાડ છ નાહવાના પૂર્વી કરવા જકાવ્યું હતું. આ વિવિધ સ્થયે મુલાકાત દરમિયાન મેથરે સ્થાનિક નાગરિકો સાથે ચેવાદ કર્યો હતો. મ્યુનિ. અધિકારીઓને ગુણવત્તામાં બાયછોડ નહીં કરવા અને સમયમર્યાદામાં કામ પૂરા કરવા સૂચના

## સાબરકાંઠામાં BZમાં રોકાણ કરનારાઓની હાલત કફોડી બની

અનેક રોકાણકારો કરિયાદ લખાવવા આગળ ન આવતાં તંત્ર અવઢવમાં

બીઝેડનં કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં આ કૌભાંડની જ ચર્ચા ચાલી રહી છે. અંક તરફ આવી લેભાગુ સ્ક્રીમમાં રોકાજ કરનારાઓની હાલત કરોડી બની છે તો બીજી તરફ સીઆઈડી કાઈમ બ્રાન્ય સમજ્ઞ કોઈ રોકાલકારો સત્તાવાર ફરિયાદ નોંધાવવા માટે આગળ આવ્યા નથી. જો કે, રીવાવારે પ્રાંતિજ તાલુકાના એક રોકાશકારે પોલીસ સ્ટેશનમાં આવી લેખિત રજુઆત કરતાં કરિયાદ નોંધાવાઈ છે.

ગત મંગળવારથી બીઝેડ કૌભાંડનો પદીકારા થયા બાદ હિંમતનગર તલોદ ઈડર, અરવલ્લીના માલપુર સહિતના અનેક ઠેકાણે બીઝેડના એજન્ટી જાહેરમાં દેખાયા નથી. રોકાશકર્તાઓ તેમને શોધી રહ્યા છે પરંતુ તેમના સંપર્ક થઈ શકતા નથી, જેથી બિચારા રોકાલકર્તાઓની

થઈ ગઈ છે. સોમવારે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં બીઝેડના કૌભાંડ અંગે અનેક લોકો પોતાની બુદ્ધિયતા મુજબ અર્થઘટન કરી કર્યા છે. કેટલાકનું માનવું છે કે, આગામી સમયમાં તેમના રોકાલો પાછા મળશે. તો કેટલાકન યાનવું છે કે, ભૂતકાળમાં બનેલી આવી અનેક ઘટનાઓ પછી ન્યાયિક પ્રક્રિયા થઈ હોવા છતાં રોકાશકારોનાં નાણાં

પરત આવ્યાં નથી. જેથી બીઝેડમાં પણ પરત ભાગ્યાં નથી, જેથી બીડેટમાં પણ ભૂતકાળની પટનાઓનું પુનરાવર્તન થાય તો નવાઈ નહી. સાલરકોઇ-અરવલ્લી, રાજસ્થાન, વહેદરા અને સીરાષ્ટ્ર સહિતના અનેક સ્થળે બીઝેના પથારામાં કેટલા લીકોનાં નાલા ફોર્મ તેની કોઈ ચીક્ક્સ વિગતો જાહેર થઈ નથી. તેમ છતાં જણકારો કહે છે કે, શીકાર્યાઈ કાર્યમાં લાગ્યાં વ્યારાનો સીઆઈડી કાઈમના હાથમાં તપાસનો દોર પહોંચી ગયો છેત્યારે જો ભુપેન્દ્રસિંહ ઝાલાએ જ્યાં કોઈપલ સ્થાવર મિલ્કત ખરીદી છે તે સરકાર ટાંચમાં લઈ શકે છે. જ્યારે કેટલાક બેન્ક ખાતાઓ પણ સીટ કરી દેવામાં આવ્યા હોવાને કારણે કોઈ લેવડ દેવડને અવકાસ નથી.

અરાઉન્ડ ધ ગાંધીનગર

### કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા વિષય પર સંવાદ યોજાયો



ગાંઘીનગર : સર્વ વિદ્યાવય કેળવણી મંડળ અને કડી સર્વ વિશ્વ વિદ્યાલયનો વપ કોલેયના સુવાનો માટે સર્વ નેતૃત્વ હમમી શિલિયાસમાં માસ્ટ સરકાર હારા નેત્રાના સુવાનો સુવાનો સામાના સ્વીધા પદીખે ઉપસ્થિત રહી "રાષ્ટ્ર નિર્માણમાં સુવાનોની ભૂમિકા" વિષય પર પેરણાત્મક સંવાદનું રહીં "ગર્ફ નિર્માણમાં સુવાનોની મૃશિકા" દિવારો પર પ્રેરાણાત્મક રેતાદનું જ્યારોબલ કરાયું હતું હતું, તેમારો જવારાયું હતું કે પોહાનો જાત પર વિશાસ રાખી, સતત ત્યારે હતું હતું તેમારો જાતારાયું હતું કે પોહાનો જોડ હતું પૂર્વકો. પોતાની જાતને અન્ય લોકોની સાથે કાયારે ચારિય તાલાના ન કરવી જાતારે હતું હતું હતું હતું હતું હતું કે તેમારે અભ્યો ચુવાન સફામ છે એ તાકાત ઓળખી આત્મવિક્યાસમૂર્શને કામાળ દવિદ્યા માટેલું માર્ગદર્શન પટું ક પાડ્યું હતું, કાર્યકાનું સકલા સર્વ દિશાસથા વળી ડો. કોમેન્દ્ર પટેલ અન્ય રાહુલામાર્થ સુવીક્યાએ કર્યું હતું.

### ગોદ્યાવીની ઝાયડસ સ્કૂલ ફોર એક્સેલન્સમાં વાર્ષિક રમતોત્સવ યોજાયો

સામંદ : ઝાલડસ સ્કૂલ ફોટ એક્સેલન્સ, ગોદાવીમાં વર્ગમે વાર્મિક દમતીસ્વાર ચોમકો હતો. બાસ્કેટ બીલની સમતના આંતરદાષ્ટ્રીય ખેલાડી લિજા ક્રીમિક અંતરિક વિચાર કરી હાર્યાં અને હાર્લાં અના ઉત્સાહમાં વહારો કર્યો હતો. વિદ્યાર્થીઓ હાર ચોગ, પિરામિક ડ્રીલ, લેક્કિયમ ડ્રીલ અને માર્ચલ આઈ સહિતની વિવિદ્ય પ્રવૃત્તિઓનું પ્રદર્શન કરાયું હતું. તિત્રય કર્યિક દેશાર્થીઓના પ્રક્રતાની પ્રવેશ કરે અને ચારિક્ય ઘડવામાં અને દીમ વર્કને પ્રોત્સાહન આપવા માટે સ્મતગમતના મહત્વ પર હતું, Lioca કોશિક દાવીકારિયાના પ્રશાનાની પ્રાથસ કરી અને ચાડિયા ઘડવામાં અંતે ટીપ વર્કને પ્રોત્સાહન શમાયા માટે સ્વાગમાના મહત્વ પર ભાર મુક્યો હતો વિકાશિંતોએ ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ, સ્વિ દોડ અને વોલીબીલ, ખો-ખો, શેલ્યુક, ડિસ્ક્સ શો, બરાઈ કેક, ઓક્ટોપસ રેસ સહિત રમતોમાં તેમનું કોશ્વલ દર્શાવ્યું હતું. ઇનામ વિતસ્તર સામાર્ટેલ ચોત્રથો હતો એમાં પ્રગૃતિ હાઉસ વિજયી બન્યું અને સર્વશ્રહ માર્ચ પાસ્ટમાં રોતના હાઉસ વિજયી બન્યું હતું

## ભાડું નહીં ભરાતાં પેથાપુરમાં પાંચ દુકાનો સીલ

ગાંધીનગર : ગાંધીનગર પ્યુનિ, રિસ્તારમાં તંત્ર હારા નજુવા ભાડાથી સેકડો ડેપારીઓએ દુકાનો આપવામાં આવી છે. મોકાનો વગ્સ પર દુકાનો સ્થાવતા વેપારીએ હારા વર્ષોથી ભારુ ભરવામાં આવતું છે. મોકાનો આપીનો વારંચાર તાઉઠ કહતાં ભાડું નહીં ભરૂનાથી દુકાનોએ સીલ મારવાનો પ્રુપેલા દ્વારા ઘરાઇ છે. મનપાની એસ્ટેટ શાળા (ઉત્તર પ્રોન) દ્વારા પેથાપુર ખારે આવેલી પાંચ દુકાનો સોમાવાર સીલ કરાઇ હતી, કુલ રા.પ્રદ્રા, ભાડું, નહીં ભરવારા પાંચ દુકાનો સોમાવાર સીલ કરાઇ હતી, કુલ રા.પ્રદ્રા, આદ્ધ, બન્નારા પાંચ દુકાનો સોમાવાર સીલ કરાઇ હતી, કુલ રા.પ્રદ્રા, આદ્ધ, અન્ય પ્રસ્તાર પાંચ દુકાનો સોમાવાર સીલ કરાઇ હતી, કુલ રા.પ્રદ્રા, આદ્ધ નહીં ભાગતા દુકાનોને સીલ કરવામાં આવે છે. સમયરાર ભાગ હતી ભાગતા

# ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠકોની નવેસરથી ફાળવણી કરાઇ

તાલુકા પંચાયતની 28 બેઠકો પૈકી હવે બિન અનામત અને સામાન્ય સ્ત્રીની 9-9 બેઠક

» 27 ટકા બેઠકો પછાત વર્ગો માટે કાળવવાની જોગવાઇના આધારે નવેસરથી રોટેશન

આગામી સમયમાં ગાંધીનગર જિલ્લાની એક માત્ર ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી આવી રહી છે. તે અગાઉ 27 ટકા સુધીની બેઠકો પછાત વર્ગો માટે ફાળવવાની જોગવાઇના આધારે નવેસરથી રીટેશન જાહેર કરાયું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બેઠકોની નવેસરથી ફાળવણી કરાઈ છે. મજબ ગાંધીનગર તા.પં.ની કલ 28 તે મુજબ ગાંધાનાર હતું. મુ બેઠકો પૈકી હવે લિન અનામત અને સામાન્ય સ્ત્રીની 9-9 બેઠક નક્કી કરાઈ છે. જે ગત ચૂંટલી વખતે બિનઅનાયત

### નવા રોટેશન મુજબ ફાળવાયેલી ૨૮ બેઠકનો પ્રકાર

GUJSAIL

ું ૦૯-૨૦૨૩થી સ્થાનિક સ્વરાજ્યની તા.પં.ની કુલ ૨૮ બેઠકો માટે આ મુજબ સંસ્થાઓમાં પછાત વર્ગોની બેઠકોની અનામતનું રોટેશન અમલી બનશે.

# લાકરોડા નદીના પટમાં રેતી ઉલેચતું હિટાચી મશીન પણ કબજે કરાયું ગાંધીનગરમાં નદીની રેતી ચોરી જતા 6 ડમ્પર સહિત 2.20 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર ક્લેક્ટર મેહુલ દવેની કડક સૂચનાના પગલે જિલ્લા મદદનીરા ભુસ્તરશાસ્ત્રીની કચેરીની ક્ષેત્રીઘટીયે હાથ પરેલી કાર્યવાહી દરમિયાન ગેરકાયદે સાદીરેતી ભરી જતાં કુલ 6 વાહનો તથા એક હિટાચી મશીન સહિત કુલ 2,20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વાલનોના માલિકો અને પરમિટ ધારકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. ગાંધીનગર જિલ્લામાં થતી ખનિજ

ચોરીને અટકાવવા જિલ્લા મદદનીશ સાદીરેતી ભરેલા કમ્પરમાંથી રોયલ્ટી ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખેનિજ ખાતાની ક્ષેત્રીયટીયને કલેક્ટર મેહલ દવેએ 24 કલાક એલર્ટ રહેવા કડક સૂચના આપી છે. તેના પગલે ભુસ્તર તંત્રએ જિલ્લાના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા ડમ્બર સહિતના વાહનોનું સઘન ચેકીંગ હાથ પર્યુ હતું.

સો વર્ષ વર્ષ પશ્ચિમ એન વોર્ડ લપર દ્વી કપાર કાંગ્ય વોર્ડિક

૦૫૬૧,૦૫૬૫ થી ૦૫૭૪ (૧૦ યોડ)એમ કુધ ૨૯ થોડે

માત્રણીની ચેપડો(ઉન્ફોરી) ની તોથી અંગે લોધઓ રજુ કરવા અંગેની સુધનાઓ :

લ્લાક થી વ્યક્સ (વર વેડી, વ્યવસ, વ્યવસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન

મહાનગર સેવા સદન

અલ્હાવાદ શહેર હદ વિસ્તારમાં આવતી પશ્ચિમ ઝોનના વોર્ડ ૦૫૨૬ થી ૦૫૩૬ (૧૧ વોડે), ૦૫૪૧ થી ૦૫૪૫

(૦૫ લોડ્રી, ૦૫૫૧, ૦૫૫૨, ૦૫૧૧, ૦૫૧૫ થી ૦૫૭૪ (૧૦ લોડ્રીએમ કુલ ૨૯ લોડીની વિચાનોના

સામન શેવા મળે જાણે લોકો છે. મેં ગુજરાત દર્વિતાનોથા મુશ્લિકા સંવિદ્ધાના મેન્ટ્રિક માં ત્યા પ્રકાર ના પ્રકાર છે. ક્ષમેશ નિયાનો ન ભાગ તે જાણ મુખ્ય મૃતિકાર હામ નાંધા તેને દર્વાં ભાગના પ્રકાર નાંધા તેને દર્વાં ભાગના મન્યા તમેનીની મેન્ટ્રેક આપ તમેનીની એને <u>૧૯૪૩નું ખુલ મેં પ્રકાર કરીનો પ્રકાર પૂર્વાં મુખ્ય માના પ્રકાર નાંધાના પ્રકાર કરી માં આપના માર્ચ કરીનો પ્રકાર નાંધાના પ્રકાર નાંધાની કરીનો માર્ચ માર્ચ માર્ચ કર્યું મન્યાદા મુશ્લિકા કોર્પોસન નો પ્રમાર્થી પ્રકારમાં કોરાકોરો પ્રકાર પ્રકાર નાંધા પ્રકાર કરીનો માર્ચ માર્ચ માર્ચ કર્યું મન્યાદા મુશ્લિકા કોર્પોસ કોર્પોસન નો પ્રમાર્થી પ્રકાર કોર્પોસ કોર્પોસ કરીનો પ્રકાર નાંધાના માર્ચ કર્યું કરીનો માર્ચ માર્ચ માર્ચ કર્યું કરીનો સામાર્ચ પણ નિર્દેશના લોધા માર્ચ,</u> સામાન્ય વેરા અંગે જહેર નોટિસ

વિવિષ્ঠ સ્થવ દેશ વિભાગ, છે. સ્મારુભાઈ પટેલ ભગ-

банауылы жылынасооға



જેમાં તા.29 નવેશ્વરે માણસા તાલુકાના દેલવાડ ખાતેથી પસાર થતા ડમ્પરમાં રોયક્કી પાસ વગર સાદીરેતી ભરેલી જ્યાઇ હતી, જેથી ડમ્પર જપ્ત કરાયુ હતું. તા.30 નવેમ્બરે ગાંધીન તાલુકાના પ્રાંતીયાથી પસાર પાસ વગરનો જથ્થો મળી આવતા ડમ્પર જપ્ત કરાયુ હતું. જ્યારે અંબાપુરથી પસાર થતા ડમ્પરમાં રોષલ્ટી પાસ વગર સાદીરેતી ઓવરલોડભરેલીજણાઇઆવી હતી. તેમજ તા.! દિસેમ્બરે લાકરોડા ખાતે સાબરમતી નદી પક વિસ્તારમાં તંત્રએ

દરાડાં પાડથાં ત્યારે હિટાયાં મંત્રીનથી નદીમાંથી ગેરકાયદે રેતી ઉલેયવામાં આવતી હોવાનું જ્યાઈ આવતા જપ્ત કરાયું હતું, એ સહિત ચાર ક્લિસ દરમિયાન કડક ચેકિંગ હાથ પરી તંત્રએ કુલ 6 વાહનો તથા એક હિટાયી મશીન ુ સહિત કુલ 2,20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે.

## ઇંટિગ્રટેડ પ્રોટીન્સ લિમિટેડ

CIN: L15400GJ1992PLC018426

Reg Office: 5th Floor, City Point, Opp. Town Hall,
Jamnagar, Gujarat - 361001, Contact: 0288 2551901,
Web: www.integratedproteins.com, Mail : ipl.complianceofficer@gmail.com

ઇન્ડિગ્રેટેડ પ્રોટીન્સ લિમિટેડ ("કંપની") ના સભ્યોને આશી સુચના આપવામાં આવે છે કે લે કલમ ૧૧૦ અને અન્ય લાગુ કોગવાઇઓ, કો કોઈ હોય તો કંપની અદિનિયમ ૨૦૧૩ (કોઈપણ વૈદ્યાનિક ફેસ્ફાર (કોઈપણ વૈદ્યાનિક ફેસ્ફાર (ઓ) સરિત) ની જોગવાઇઓને અનુમરે છે. તે અંગેનો અદિનિયમ (ઓ) હાલ અમલમાં છે "અદિનિયમ") ઇપનીંગ (મેનેજમેન્ટ એન્ડ એક્સિનિક્સ્ટેશન) નિયમો ૨૦૧૪ ના નિયમ ૨૦ અને નિયમ ૨૨ સાથે વાંચો ("નિયમ") પરિપત્ર નંબર ૧૪/૨૦૨૦ તારીખ ૦૮ એપ્રિલ ૨૦૨૦, ૧૯/૨૦૨૦, તારીખ ૧૩ એપ્રિલ ૨૦૨૦ ૨૦/૨૦૨૦, તારીખ ૨૦ મે ૨૦૨૦ ૨૨/૨૦૨૦ 

અને અલ્ય લાગુ કાયદા, હિયમો અને વિનિધમોને આદીન (કીપોયા વૈદ્યાનિક ઉરકાર સહિત અલ્યા તેનો પૂન-અશિનિયમ (તે)) હાતા ના સ્વચ માટે અનાલતો છે. કુચ્ચ કે નાર્ડિંડ ગ્રાંગ પોસ્ટલ લોકે ("ધ પોસ્ટલ બેકેલ") હાય અહી નિધારિત વ્યવસાય માટે કંપનીના સેશ્કારકોની મંજૂરી મેળવવા માટે ("ઇ-વોંઠિ")) પ્રક્રિયા. બીટીરા તે રાજ્યોને ઇલેકટ્રોનિક રીતે મોકવવામાં આવી છે. ઇમેલ એટ્સ કંપની પારો ઉપલબ્ધ હતા અલ્યા અલ્યા સ્વચ્ચેમ ઇલેકટ્રોનિક રીતે મોકવવામાં આવી છે. ઇમેલ એટ્સ કંપની પારો ઉપલબ્ધ હતા અલ્યા અલ્યા સ્વચ્ચેમ ઇલેકટ્રોનિક રીતે મોકવવામાં આવી છે. ઇમેલ એટ્સ કંપની મોઘમી કરાવી નથી સેલના માટે કંપની મોઘમી કરાવી નથી સેલના માટે કંપની બારાઇક એટલે કં www.integrated.profeins.com પર અપલોક કરવામાં આવી છે અને BSC ની વેબરાઇક એટલે કં https://www.bseindia.com/. પર સભ્યોના માટાના અધિકારીઓ કર-ઓફ તારીએ કંપનીના પોર્ટક-આપ ઇનિવરી રેષ્ટ મુકીના તેમના પ્રમામાં હશે ચૂકાવા રસ મો નવેમ્બર રસ્તર કં માર્મિક સંત્રી માર્ચક સ્વાય કંપનીના મોઇ-આપ ઇનિવરી રેષ્ટ મુકીના તેમના પ્રમામાં હશે ચૂકાવા રસ મો નવેમ્બર રસ્તર કંપનીના પોર્ટક-આપ ઇનિવરી રેષ્ટ મુકીના તેમના પ્રમામાં હશે ચૂકાવા રસ મો નવેમના માર્ચક સંત્રી કંપનીના મોઇ-આપ પાર્ટકાના (સિસ્ટી)ના ઓભિડમેલના એક કંપનીમાં (એન્બરમેલ એક એકમિલ્ફેશનાને) બિચમાં રચ્યોએ કંપની સંત્રી સાથે સેશનો મોર્ચક પાર્ચક કંપની સાથે કંપની સંત્રી સાથે કંપની માત્ર કંપના પાર્ચક સંત્રી માત્ર કંપની સાથે તેમના મત આપવાના અધિકારનો ઉપયોગ કરવાનો મોર્ટલિયા અને આપા મદાકાના દ્વારા લાયાય વ્યવસા શર્ચ કંપની સાથે સાથે સાથે હામો અલ્યા માત્રી કંપની કંપની સાથે સાથે સર્વા સંત્રી સંત્રી કંપની હામાં સાથે સર્વા માત્ર કંપના સાથે માત્રી કરવાના સર્ચો. નોર્ટરમાં ઇલિકાર વચાચ માટે, બોલિક સ્વયામાં માર્ચક કરવાના મોર્ટલિયા અલ્યા તે પહેલાં કંપની દર્શીનેલ વ્યવસાયો અલ્યા સર્વા કરવાના માત્ર કંપની સ્વયસ સાથે કરવાના માત્રી કંપનીલ માટે કરવાના માત્રી કંપનીલ સાથે કરવાના માત્ર કંપનીના સરચ બચા મોર પર્વા કર-એક સ્વયસ સર્વા કરવાનો માત્ર કરવાના માત્ર કરવાન માત્ર કરવાના માત્ર કરવાન માત્ર કરવાન માત્ર કર

નાકલા રહે છે. જો કર્દ્દ સભ્ય પોસ્ટલ બેલેટ નોટીસની પ્રિન્ટેંડ કોપી મેળવવા ઇચ્છે છે, તો કંપની સભ્યની વિનંતીની પ્રાપ્તિ પર, તે મકતમાં મોકલશે. જો તમને ઈ-વોર્ટિંગ રાંબંધિત કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય, તો પ્રાાવ પર, ત મહત્વના માનલસા. જા તમન છ વ્યાદગ દાળાદાવ કાંદ્ર પ્રખ્યા જાયના દામત્યાંગા હતા, તા તમે મદદ વિભાગ હેઠળ www.evoitingindia.com પદ ઉપલબ્ધ વાર્ચવાર પૃષ્ઠાના પ્રખનો ("FACS") અને ઇ–પોર્ટિંગ મેન્ચ્યુઝાલનો સંદર્ભ લઈ સકો છો અથવા evoling@nsdi.co.in પર ઇમેલ લખી શકો છો. આ સ્થાના અમારી વેબસાઇટ www.inlegratedproteins.com પર ઉલબ્ધ વસે. વધૂમાં આ કદતાવેખો માટે ઉપલબ્ધ છે. વધુમાં, આ દસ્તાવેજો ઓફિસ સમય દરમિયાન કંપળીની નોધાએલ ઓફિસમાં તપાસ માટે ઉપલબ્ધ છે.

।रीभ : ३० नवेभ्जर, २०२४

स्थल : जमनगर

કોર. ઇંટિયટેક પ્રોટીન્સ વિમિટેક સહી/-સી.એસ. દેવાંશી વી. શહ કંપની સેકેટરી મેમ્બરશીપ નં. A50711

### ગાંધીનગરમાં તમામ 16,000 વડીલોને 31 ડિસેમ્બર્સુધીમાં વય વંદના કાર્ડ અપાશે



» આર્થિક-સામાજિક સ્થિતિને ધ્યાને રાખ્યા વગર 70 વર્ષથી વધુ વયના 12,000 લાભાર્થીને વય વંદના કાર્ડ મળ્યાં

**નવગજરાત સમય** > ગાંદીનગર

**==** 70 વર્ષથી વધુના વડીલો માટે 10 વર્ષથી લધુના વહીલા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વય વંદના યોજનાનો અમલ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નવેન્દ્ર ભાઈ મોટીએ જાએક રહેલી આ યોજનામાં 70 વર્ષથી લધુના વચના તથામ વૃઢોને સામાજિક આર્થિક વર્ષિતને ખાનમાં આવતી હેવામાં આવશે હેવામાં આવશે હેવામાં આવશે હેવામાં આવશે હેવામાં આવશે હેવામાં આ પ્રધાનમંત્ર ખાનમાં આવતી હેવામાં આ પ્રધાન છે. આ તમામને 31 રિસેમ્બર સુધીમાં વય વંદના કાર્ડ આપવાનું આ યોજન હાથ ધરાયું છે.

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલની પ્રેરણાથી મવર મારાજન પટલના પ્રશાશ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હારા સેક્ટરો તથા આવ્ય વિસ્તાર અને સોસાયટી વિસ્તારમાં કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્ડનો ઉપયોગ સરકાર માન્ય તમામ PM-JAY સંવગ્ન હોસ્પિટલમાં થઈ શકશે. અગાઉથી PMJAYના કાર્ડ મળ્યા હોય તેમણે નવીન કાર્ડ કહાવવાની જરૂર નથી.

ગાંધીનગર મહાનગરપાલિકામાં કલ 16000થી વધુ લાભાર્થી નોંધાયેલ છે, જેમાંચી 5000 વ્યક્તિઓના કાર્ડ યોજના પહેલા જ કાઢવામાં આવેલ છે તેમજ હાલમાં યોજના લાગુ થયેથી અત્યાર સુધીમાં 7,000 થી વધુ કાર્ડ કાઢવામાં આવેલ છે. આમ 12,000 જેટલા વ્યક્તિઓના કાર્ડનીકળી ગયા છે અને બાર્કી રહેતા 5000 લાભાર્યીઓના 31 ડિસેમ્બર 2024 પહેલા વયવંદના કાર્ડ આપવા મેયરે સચના આપી છે.

### TENDER NOTICE

GUISAIL) A Covt of Guarat Uncertaine Company Limite (GUISAIL) A Covt of Guarat Uncertaine, GUISAI Complex, Nr. Torrent Sub Station, SVPI Airpon Ahmedabad-388 004. Ph No. 1970. 1980.

Tender is invited from the Experienced Agencies for Providing VMP Cabin Work at Water Aerodrome Sabarmati Riverfront, Ahmedabad, Interested bidders my download the tender document from www.gujsall.gujarat.gov.in within the stipulated time.

09/12/2024 Last date for submission of bids at 18:10 hrs

ારાબ કાર્યપાલક ઈજનેરલી પાણી પુરવાલ (મા.મ) પૈદા વિભાગન મી મલોક લોલો માત્ર, લાક્ષાપુર લઠુમાલી ભવન,સપદાવાદ-૩૮૦૦૫૨ (ફ્રેંસ ને ૦૭૧-૨૮૯૧૦૦૭૦)ની કપેરી સારા માર્ગ અને મકાન વિસાગના ૭-૨ વર્ગ અને ૪૫૨ની કવાની નોંચણી પરાવનાદ માન્ય કારેય પાર્ચ હતાં નાકા (ઉલાઇના) હતે તમે અને ઇપનો કાંકાની નોંધણી પોલાનામાં માન્ય કેકારી પાર્ચી કેકા 2 500 લાલા સુધીની લોકાદુર દરખાન્ય કરતા કરે તો કરીનો લાધી પોલાનાથો અંતરે છે. આ કાર પાર્ચે કેશ, કેનાને આપાનની છેલતી તા. હામ રાજ્ય કુપી કરીનો કાંચામાં આ દરિક્ષાના વાર્ચના કરતા કરતા કુપી લાંધામાં આવે . ખેતે તેઓ કેનારી જ્યાં એને ક્ષાંત્ર અને તે પોતાની પરના લીકારામાં છેલ્લી તા. ૧૯૧૧ રાજ્ય કુપાર્ચ ૧૯૦૦ કહ્યાં પેલ કલ્લા સુધી રેશી. લાલ કર્માં તો શરૂર કેનારો તા. ૧૯૧૦ કરવા પેલ ૧૯૦૦ કહ્યાં પેલ કિલ્લામાં કરીને કેશના કમાન કર્માં તો શરૂર કેનારો તા. ૧૯૧૦ કહ્યાં પેલ ૧૯૦૦ કહ્યાં પેલ

का अपनी विज्ञालया लोडीस अवेशीयां और पर मनवामा कावेल से उपरोक्त स्वेशीनी જાહેર રજા વિવાયનો દિવસીમાં રહ્ય ધરાવાના ઈજારાદારથીએ સ્વર સંપાર્ટ સ

### જાહેર નિવિદા નં.૧૭ સને ૨૦૨૪–૨૫

# જેવલ લક્ષ્મી ઉત્તરના દેશ માં બલાવા મુજબની ગુરુની એટ લોધ અલ્ક કરવામાં નહીં આવે તો તેને આતારોની ચોપ્પીના (ઇન્ફેર્કેઓ) વિભાગોના કેસ ત્યાં અંદી વધી નહીં એને ગણવામાં અવશે અને તે ઉપા લેધના પતા કા લઈકાર કિત્રે આદર્શ વસુધા કરવાની પ્રવર્શન તળાઉલ હાથ પરદામાં આવશે. માંસમેર મેન્ડ દેશ ક્લેકાન ખત્ મૃતિસિધ્ય કેવીસન

# અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

344 5H	हेनामेन्ट नंधर	કર ભરવાને પ્રથમપાત્ર વ્યક્તિનું નામ	कलकुद्दारम् नाम	સરનામું	બાકી ટેશની રકમ (ફપિયા) 3૧-૦3-૨૪ સુદી
1	०४०१-२८-३७८७-००२७-आई	, व्यासहार सरकार	લક્ષ્મી કૂપા ફાઈબર દસ્વાજા શિરાગભાઈ સોલંકી	નટસિંફ કોલોની વાસણા પોલીસ ચોંકીની બાજુમાં મક્તમપુર, વાસણા અમદાવાદ - ૩૮૦૦૦૭	<i>૭,૫૭,૫૬૨/-</i>
4	०५०९-०४-०४४५-०००९-४	અદિતી એસોસિયેશન / જિગીપાબેન /અશોકભાઈ પટેલ	सायजर जोन टेडनोदोजीस	શર્ક ફ્લોર ૩૦૨, કરિકૂપા બિલ્ડિંગ વાસણા દેવિફોન એક્સ્પેંજની સામે વાસણા અમદાવાદ-૩૮૦૦૦	30,53,248/-
3	०४०२-२९-०७२५-०००२-वी	પાશ્વ પદમાવતી એસોસિયેરાન આલફા સાઘનમ એકેડેમી સેક્ટર ફસોર પાશ્વ પદમાવતી pvr. Ltd કોમ્પ્લેક્સ જ્યારી પ્રવાચની સામે ત્રેષસ કોરિયા પાસે વારાણા અસ્દ્રાયાદ ૩૮૦૦૦૭		11,14,605/-	
٧	o401-1@-1∠08-0001-€	માન વીજય એસોસિયેશન ! શારદા લજપતરાથ રનોમલ	મહેશ્વરી ઝાફક સફકારી ભંડાર	એ/જી.એફ./૩૪ મંગળતીર્થ કોમ્પ્લેક્સ હરણીંઘર દેશસરની સામે વાસણા,	C.31/6441-

# <u>જાહેર નોટીસ</u> ( ટેક્ષ ખાતુ - પશ્ચિમ ઝોન) પ્રોપર્ટી ટેક્ષ ન ભરનારાઓની મિલકતની જાહેર દરાજી અંગેની નોટીસ

રમામાં વાદ ખ્યુપ્તિમિયત કોપોરેશન તરફાર્યો પ્રોપ્ટી રહ્યાન બીનો મોકલવા છતાં તેમજ વારંપાર નોટીસ વિગેર સમયવા દર્શા નીચે જણાવા કરાતન તરફાર્યો રહ્યા ભરવામાં આવે. નથી તેવા કરાતાઓને પાની પોર્ટર બરાવી તેમની મિરાકની હરફામાં પુકારાનું નકડી કરવામાં આવેલ છે. તેના ભગવાન નીચે જણાવા મિલાકનો હરફામાં મુકાવે, જે કરાત મોતાની મિલાકનો હરફાયાંથી મુકલ કરવા પાઝન હેવા તેઓએ પોતાની મિલાકનો જાકી રહ્યા આ નોટીસવા દિન-પામાં ભારી રહ્યાં, જો શાર સમય મચોદમાં બાકી ટેશની દરક બરાવાર્ય નાઈ કરવામાં આવે તો સાર મિલાકનોની હરફા કરવામાં આવેલે. હરફાની તાર્કમ ટ્રેટ સમામાં જાહેર કરવામાં આવશે.

24 oj 54 i	देवामेन्ट नंबर	કર ભરવાને પ્રદેશપાત્ર વ્યક્તિનું નામ	કલફદારનું નામ	સરતામું	બાદી ટેશની રકમ (રૂપિયા) ૩૧-૦૩-૨૪ સુધી ભૂપભૂપક રહ
1	०४०१-२८-३७८७-००२७-आर्छ	, व्यासहार सरकार	લક્ષ્મી કૂપા ફાઈબર દરવાજા ચિરાગભાઈ સોલંકી	નરસિંદ કોલોની વાસણા પોલીસ ચોંડીની બાજુમાં મક્તમપુર, વાસણા અમદાવાદ - 3૮૦૦૦૭	
4	०५०१-०४-०४४५-०००१-४	અદિતી એસોસિયેશન / જિગીપાબેન 'અશોકભાઈ પટેલ	સાયબર ઝોન દેકનોલોઝીસ	શર્ક ફલોર ૩૦૨, હરિફૂપા બિલ્ડિંગ વાસણા દેવિફોન એક્સ્પેંજની સામે વાસણા અમદાવાદ- ૩૮૦૦૦	30,53,442-
3	०४०१-१९-०७१५-०००१-वी	પાશ્વ પદમાવતી એસોસિયેરાન	આલફા સાયન્સ એકેડેમી pvt. Ltd	સેકન્ડ ફ્લોર પાલ પદમાવતી કોમ્પ્લેક્સ જયદીપ ટાવરની સામે શ્રેચસ કોસિંગ પાસે વાસણા અમદાવાદ-૩૮૦૦૦૭	11,14,609/-
*	o401-16-1205-0001-ff	માન વીજય એસોસિયેરાન ! શારદા લજપતરાથ રનોમલ	મહેશ્વરી ઝાફક સફકારી ભંડાર	એ/જી.એફ./૩૪ મંગળતીર્થ કોમ્પ્લેક્સ ધરણીધર દેશસરની સામે વાસણા, અમદાવાદ - ૩૮૦૦૭	£,37,69¥/-